

ધ્રોલ નગરપાલિકા – ધ્રોલ

:::: ટેન્ડર ઓફર ની જનરલ શરતો ::::

- (૧) આ ટેન્ડર આઈટમ રેઈટ બેઈઝ પર માંગવામાં આવેલ છે જેમાં ભાવ ઈજારદારે ભરવાના રહેશે.
- (૨) દરેક આઈટમના અંદાજીત જથ્થામાં ગમે તેટલો વધારો કે ઘટાડો થઈ શકશે. અને કોઈ આઈટમ સંપૂર્ણપણે રદ થઈ શકશે કે નવી આઈટમ ઉમેરી શકાશે. આમ છંતાય આવી આઈટમ કે આઈટમના જથ્થાના ફેરફારથી ટેન્ડરમાં બતાવેલ આઈટમ ના ભાવમાં કોઈપણ જાતનો ફેરફાર થશે નહીં. કોન્ટ્રાક્ટરને દરેક લાગુ પડતી આઈટમની ચુકવવાપાત્ર થતી રકમ કોન્ટ્રાક્ટ મુજબ સાઈટ પર દેખરેખ થયેલ કામના માપ પરથી ચુકવવામાં આવશે. ટેન્ડરમાં બતાવેલ આઈટમ રેઈટના બધા જ માલ સામાન તથા મજૂરીના ખર્ચનો સમાવેશ થઈ જાય છે અને તે બાબતે કોઈપણ જાતની વધારાની રકમ ચુકવવામાં આવશે નહીં. નવી ઉમેરેલી આઈટમના ભાવ ટેન્ડરમાં તે પ્રકારની આઈટમના ભાવ ઉપર થી અથવા તો રેઈટ એનાલીસીસ બનાવીને તે ઉપરથી અથવા તો ચાલુ બજારના ભાવો ઉપરથી નગરપાલિકા નક્કી કરે તે મુજબ ઠરાવવાના રહેશે.
- (૩) શેડ્યુલમાંની કોઈપણ આઈટમ કે આઈટમના વર્ણન કે જથ્થામાં થયેલી ભુલ કે ક્ષતિ ના કારણે આ કોન્ટ્રાક્ટનો ભંગ થયો ગણાશે નહીં પરંતુ તેને ફેરફાર તરીકે ગણવામાં આવશે.
- (૪) ટેન્ડરમાં જણાવેલ તમામ સ્પેશીફિકેશનને ધ્યાને લઈ ભાવ ભરવાના રહેશે. તદ ઉપરાંત જો કોઈ વધારાની સુવિધા આપના દ્વારા આપવાની થતી હોય તો તેના માટે અલગથી તમામ વિગતો સહ અલગથી લેટરપેડ ઉપર ભાવ આપવાના રહેશે.
- (૫) આ ટેન્ડર ઓફરની સાથે ટેન્ડરના તથા ચીફ ઓફીસરના સંયુક્ત નામો ની ફિક્સ ડિપોઝીટ રસીદ કોઈપણ રાષ્ટ્રીયકૃત બેંકની અર્ને સ્ટમની ડિપોઝીટ પેટે જોડવાની રહેશે. તેમજ કામનાં થતા બિલમાંથી પ્રવર્તમાન દર મુજબ ઈન્કમેટેક્સ તેમજ બીલમાંથી ૨.૫૦% મુજબ સિક્યોરીટી ડિપોઝીટ કપાત કરવામાં આવશે. તેમજ ભાવ મંજૂર થયાથી ૨.૫૦% મુજબ સિક્યોરીટી ડિપોઝીટ ભરવાની રહેશે આમ કપાત કરેલ તથા ભરેલ ડિપોઝીટ મળી કુલ ૫.૦૦% ડિપોઝીટને પ્રોજેક્ટ સંતોષકારક રીતે પુરો થયે કમ્પ્લીશન સર્ટીફિકેટ મળ્યેથી એક-વર્ષ સુધી ધ્રોલ નગરપાલિકામાં પરફોર્મન્સ બોન્ડ રૂપે જમા રાખવામાં આવશે. તેમજ દરેક બિલ થયેલ કામના આઈટમ રેઈટ મુજબની રકમના ૧૦૦% રકમની ચુકવણી કરવામાં આવશે તેમજ દરેક રનીંગ/ફાઈનલ બિલમાંથી અગાઉ ચુકવેલ પેમેન્ટ બાદ કરવામાં આવશે તેમજ દરેક રનીંગ/ફાઈનલ બિલમાંથી ૫.૦૦% મુજબ રીટેન્શનમની કપાત કરવામાં આવશે જે રકમ સંપૂર્ણ કામ પુર્ણ થાય અને ફાઈનલ બિલના પેમેન્ટ થયાબાદ કમ્પ્લીશન સર્ટીફિકેટ મળ્યાબાદ છુટી કરવામાં આવશે. થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન એજન્સીએ પોતાના ખર્ચે કરી રીપોર્ટ નગરપાલિકામાં સબમીટ કરવાના રહેશે.
- (૬) આ ટેન્ડર ઓફરની કાયદેસરતા આ ટેન્ડર ખુલ્યા પછીથી ૧૨૦ દિવસ સુધીની રહેશે.
- (૭) ટેન્ડર ઓફર ભરતા પહેલા ટેન્ડર કામના સ્થળની પુરી તપાસ કરીને જમીનના લેવલ જમીનના પ્રકાર ઈલેક્ટ્રીક પાવર અને પાણી વ્યવસ્થા વિગેરેની સંપૂર્ણ જાણકારી મેળવેલ છે તેમ માનવામાં આવશે. સાઈટકન્ડીશનને કારણે ઉદભવેલા કોઈ પણ દાવાને ધ્યાનમાં લેવામાં નહીં આવે.
- (૮) અધુરી અથવા અસ્પષ્ટ ઓફરને ગેરલાયક ઠરાવી શકાશે.
- (૯) કોઈપણ કારણ દર્શાવ્યા વિના કોઈપણ એક કે બધીજ ટેન્ડર ઓફરો રદ કરવાનો કે સ્વિકારવાનો હકક અમોને અબાધીત રાખેલ છે.
- (૧૦) કામ અંગેના તમામ હકક અધિકાર નગરપાલિકાને અબાધીત રહેશે.

ધ્રોલ નગરપાલિકા – ધ્રોલ

:::: કોન્ટ્રાક્ટની શરતો ::::

(૧) સમય મર્યાદા :

અગાઉ જણાવેલ સમય મર્યાદા વર્ક ઓર્ડર આપ્યાની તારીખ થી અમલમાં આવી ગયેલ ગણાશે સમય મર્યાદા એ આ કોન્ટ્રાક્ટ ની અગત્ય ની શરત ગણાશે એટલે કોન્ટ્રાક્ટરે આ કામ ઉપરોક્ત સમય મર્યાદા માં કે તેથી વહેલુ પુરૂ થાય તેવા શક્ય તમામ પ્રયાસો કરવા જરૂરી છે .

(૨) સ્પેસીફિકેશન :

કોન્ટ્રાક્ટરે દરેક કામ સંપૂર્ણપણે સ્પેસીફિકેશન પ્રમાણેજ કરવાના રહેશે નગરપાલિકા વતી કન્સલ્ટીંગ એન્જીન્યરે આપેલ ડિઝાઈન,ડ્રોઈંગ કે સુચના ઓ લેખિત સ્વિકારીને આવું કામ કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. બધીજ વખતે પી.ડબલ્યુ.ડી. હેન્ડ બુક વોલ્યુમ: ૧ અને ૨ અને ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ઈન્સ્ટીટ્યુટ દ્વારા આપેલ સ્ટાન્ડર્ડ સ્પેસીફિકેશનનો અમલ કરાશે

(૩) દસ્તાવેજોની ગુપ્તતા :

આ ટેન્ડર ડોક્યુમેન્ટમાં આપેલ કોઈપણ જાતના દસ્તાવેજ કે ડ્રોઈંગ નો સીધો કે આડકતરી રીતે ટેન્ડર કે કોન્ટ્રાક્ટર ના કામ સિવાઈ બીજા કોઈપણ હેતુ માટે ઉપયોગ કરવો નહી.

(૪) આખરી નિર્ણય :

સ્પેસીફિકેશન,ડ્રોઈંગ, માપસાઈઝ કામની ગુણવત્તા આઈટેમ રેઈટ,બીલ,કોન્ટ્રાક્ટની શરતો, કામનો જથ્થો, કામનો પ્રોગ્રેસ,સમય મર્યાદા,ટેન્ડર શરતોના અર્થ,સ્પષ્ટીકરણ અને મુલ્યાંકન વિગેરે તમામ ટેકનીકલ બાબતો માટે નગરપાલિકાનો નિર્ણય આખરી અને બન્ને પાર્ટીઓને બંધનકર્તા રહેશે.

(૫) પેમેન્ટની શરતો :

(અ) સિકયોરીટી ડિપોઝીટ એજન્સીએ ભાવ મંજૂર થયાથી ૨.૫૦% મુજબ એફ.ડી.આર. સ્વરૂપે ભરવાની રહેશે તેમજ બિલ માંથી ૨.૫૦% મુજબ કપાત કરવામાં આવશે.આમ કુલ ૫.૦૦% મુજબની સિકયોરીટી ડિપોઝીટને પ્રોજેક્ટ પુર્ણ થયા બાદ કમ્પલીશન સર્ટીફિકેટ મળ્યે પરફોર્મન્સ બોન્ડ રૂપે જે ૧-વર્ષ માટે નગરપાલિકામાં વગર વ્યાજે જમા રાખવામાં આવશે. કોન્ટ્રાક્ટર જો પોતાનું કામ અધુરુ છોડે અથવા તો સમય મર્યાદામાં પુરૂ ન કરેતો નગરપાલિકા પોતાનાનિર્ણય થી ડિપોઝીટ જપ્ત કરી વસુલ થયેલ ગણાશે.

(બ) દરેક બિલ થયેલ કામના આઈટેમ રેઈટ મુજબની રકમના ૧૦૦% રકમની ચુકવણી કરવામાં આવશે તેમજ દરેક રનીંગ/ફાઈન બિલમાંથી અગાઉ ચુકવેલ પેમેન્ટ બાદ કરવામાં આવશે તેમજ દરેક રનીંગ/ફાઈન બિલમાંથી ૫% મુજબ રીટેન્શનમની કપાત કરવામાં આવશે જે રકમ સંપૂર્ણ કામ પુર્ણ થાય અને ફાઈનલ બિલના પેમેન્ટ થયાબાદ કમ્પલીશન સર્ટીફિકેટ મળ્યાબાદ છુટી કરવામાં આવશે.

(ક) કોન્ટ્રાક્ટરના દરેક રનીંગ/ફાઈનલ બિલ તથા કામ પેટેના ચુકવણા માંથી સરકારશ્રીના ધારાધોરણ મુજબ ઈન્કમેટેક્સ નગરપાલિકા દ્વારા કપાત કરી સરકારશ્રીના નિયત હેડે ભરી દેવામાં આવશે.

(ડ) મંજૂર થયેલા ભાવો ઉપર કોઈપણ સંજોગોમાં ભાવવધારો (પ્રાઈઝ એક્સકેલેશન) આપવામાં આવશે નહી.

(ઈ) કોન્ટ્રાક્ટર દર કેલેન્ડર માસમાં વર્ક પ્રોગ્રેસનું દરેકનું એક અથવા બે-બીલ રજૂ કરી શકશે.

(૬) પેનલ્ટી બોનસ :

કોન્ટ્રાક્ટરને આપેલ સમયમર્યાદામાં કોન્ટ્રાક્ટર જો સંતોષકારક રીતે કામ પુરૂ ન કરી શકે તો કોન્ટ્રાક્ટર પાસેથી દૈનિક ૧% થી ૧૦% મુજબ જેટલા દિવસ મોડુ થયુ હશે તેટલા દિવસની પેનલ્ટી નગરપાલિકા ના નિર્ણય ઉપર વસુલ કરવા માં આવશે.આ પેનલ્ટી ઉપરાંત કામ મોડુ પુરૂ કરવાની કે કોન્ટ્રાક્ટરની ભંગ કરવાથી નગરપાલિકાને થયેલ સીધી ખોટ કે નું કશાનું વળતર કોન્ટ્રાક્ટર પાસેથી વસુલ કરવામાં આવશે.

(૭) એક્સટ્રા આઈટેમો :

એક્સટ્રા આઈટેમો કે એક્સટ્રા કામો માટેના રેઈટ બજારભાવો તથા રેઈટ એનાલીસીસ અને કોન્ટ્રાક્ટરમાં આવતી તે જાતની આઈટમના ભાવ ઉપરથી નક્કી કરવામાં આવશે. આવી એક્સટ્રા આઈટેમો એક્સટ્રા કામોના નગરપાલિકાએ નક્કી કરેલા ભાવ આખરી અને બન્ને પાર્ટીને બંધનકર્તા રહેશે.

(૮) બ્રાન્ડ (મેઈક) :

જ્યાં જ્યાં કોઈ કામ માટે નગરપાલિકાના એન્જીન્યર કોઈ મટીરીયલ્સ માટે કોઈ ચોકકસ બ્રાન્ડ કે મેઈક દર્શાવેલ હોય ત્યાં કોન્ટ્રાક્ટરે તેજ વસ્તુ વાપરવાની રહેશે. કોન્ટ્રાક્ટર આવી વસ્તુઓની સમકક્ષ બ્રાન્ડ કે મેઈક નગરપાલિકાના એન્જીન્યરની પૂર્વ મંજૂરી લીધા પછી વાપરી શકશે. અને આવી પૂર્વ મંજૂરી આ ફેરફાર માટેના કોન્ટ્રાક્ટરે રજૂ કરેલા બધા કારણો લક્ષમાં રાખીને આપવામાં આવશે.

(૯) નકકી આઈટેમ રેઈટ :

આ કોન્ટ્રાક્ટમાં આવતી તમામ આઈટેમોના નકકી કરેલ અને બન્ને પાર્ટીઓએ સ્વિકારેલા ભાવે કામ પુરુ થાય ત્યાં સુધી કાયમ રહેશે તેમજ ભાવ વધારો કે બિજા કોઈપણ કારણોસર કોઈપણ જાતનો ફેરફાર આ ભાવોમાં કરી શકાશે નહીં બેઝીક રેઈટના ભાવ ફેર તથા એક્સ્ટ્રા આઈટેમ કે એક્સ્ટ્રા કામમાં નગરપાલિકા દ્વારા નકકી કરાવેલ ભાવ ફાઈનલ ગણાશે

(૧૦) કામનો વિલંબ :-

નગરપાલિકાને કોન્ટ્રાક્ટમાં આવતું કોઈપણ કામ અથવાતો તેનો કોઈભાગનું કામ કરવામાં વિલંબ કરવાની સુચના આપવાનો અધિકાર રહેશે. જો આવો વિલંબ કોન્ટ્રાક્ટરના કોઈપણ જાતના વાક વગર કરવામાં આવશે. તો નગરપાલિકાના નિર્ણય મુજબ સમય મર્યાદામાં તેટલો વધારો કરી આપવામાં આવશે.

(૧૧) મોડીફીકેશન :-

આ કોન્ટ્રાક્ટની કોઈપણ શરતો કે જોગવાઈઓ ફેરફાર કરવાની જરૂર જણાયતો આવા ફેરફાર લેખિતમાં કરવાની રહેશે એમાં બન્ને પાર્ટીઓએ સહી કરીને કરવાના રહેશે. અને આ નથાય ફેરફાર વાળું કોઈપણ કામ કરવાદેવામાં આવશે નહીં સમગ્ર કોન્ટ્રાક્ટ અથવા તો તેની કોઈપણ શરતો રદ કરતી વધારો કરેલ કે પુરક કોઈપણ જાતનો મૌખિક કે લેખિત હુકમની જવાબદાર જયા સુધી તેમાં નગરપાલિકાની સહી ન થાય ત્યાં સુધી નગરપાલિકાની રહેશે નહીં અને ત્યાં સુધીના આવા હુકમો રદ કરી શકાશે આવીજ રીતે નગરપાલિકાના એન્જિનિયરને લેખિત ઓર્ડર આપી આ કોન્ટ્રાક્ટ માટેનું કોઈપણ કામ વધારવાનો વિસ્તારવાનો ઓછું કરાવવાનો તથા ડીઝાઈન, સાઈઝ, જથ્થો, માપ, કે મટીરીયલનો ઉપયોગનો ફેરફાર કેબદલવા નો તથા કોઈ વધારાનું કામ લેખિત હુકમ થી કરવાનો કે કોઈ ન કરવાનો અધિકાર છે. આવા વધારાના ખરેખર થયેલ કામ તથા વપરાયેલ મટીરીયલ્સ પ્રમાણેપેમેન્ટ કરવામાં આવશે. કોઈપણ જાતના વિસ્તરણ સંકોચન વધારો કે ઘટાડો કે ફેરફાર ને કારણે આ કોન્ટ્રાક્ટની કાયદેસરતાને કોઈ અસર થશે નહીં પરંતુ કોન્ટ્રાક્ટરે આવા કામો કોન્ટ્રાક્ટ માટેનાજ ગણી કોન્ટ્રાક્ટની દરેક શરતો લાગુ પાડીને સ્પેસીફિકેશનમુજબજ કરવા ના રહેશે આવા કામના વિસ્તરણ ઉમેરો સંકોચન ઘટાડો ફેરફાર કે સુધારા વધારા ના સમયે નગરપાલિકાના એન્જિનિયરના નિર્ણય મુજબ ટેન્ડરની આઈટેમોના રેઈટ ઉપરથી નવા રેઈટ નકકી કરી પેમેન્ટ કરવાનું રહેશે.

(૧૨) કોન્ટ્રાક્ટ ટર્મીનેટ કરવા માટે:-

કોઈપણ સમયે જો નગરપાલિકાના એન્જિનિયરને એવું જણાશે કે કોન્ટ્રાક્ટરને આપેલ કામ યોગ્ય સમયે શરુ નથી થયું અથવા તો કોન્ટ્રાક્ટરે લાવેલ માલ મટીરીયલ્સ અથવા તો તેની વર્કમેન શીપ સંતોષકારક નથી તો નગરપાલિકાને આ કોન્ટ્રાક્ટ ૭ દિવસ ની લેખિત નોટીસ આપીને ટર્મીનેટ કરવાનો અધિકાર છે અને બાકીનું કામ અન્ય કોન્ટ્રાક્ટર પાસે મુળ કોન્ટ્રાક્ટરના જોખમે અને જવાબદારીએ પુરુ કરવાનો અધિકાર છે આવી બાબતો માં નગરપાલિકાના નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે.તદ ઉપરાંત કામ શરુ કર્યા પછી કોઈપણ સમયે કોઈપણ કારણો સર જો નગરપાલિકાના કારણોસર જો નગરપાલિકાને કોન્ટ્રાક્ટઅમાં દર્શાવેલ સમગ્રકામ અથવાતો તેનો કોઈભાગ કરવાની જરૂર ન લાગે કે ઈચ્છાન થાયતો નગરપાલિકા કોન્ટ્રાક્ટરને લેખિતનોટીસ આપીને કામ બંધ કરાવી શકશે જો નગરપાલિકા દ્વારા કોન્ટ્રેક્ટ ટર્મીનેટ કરવામાંઆવે અથવાતો સમગ્ર કામ કે તેનો કોઈ ભાગ કેન્સલ કરવામાં આવેતો કોન્ટ્રાક્ટરને સમગ્ર કામ પૂર્ણ થયે થવો જોઈતો નફો કે લાભ કે આવુ કામ ન કરવાથીન થયુ તે બાબતનું કોઈપણ જાતનુ વળતર કે ચુકવણુ આપવામાં આવશે નહીં આમ છંતા તે કોન્ટ્રાક્ટરે કરેલા ખરેખર કામના માપ મુજબ નકકી કરેલ ભાવ પ્રમાણેનું પેમેન્ટ કરી આપવામાં આવશે.

(૧૩) લવાદી:-

આ કોન્ટ્રાક્ટમાં આવરી લેવાયેલ ટેન્ડરની શરતો અથવાતો એમાં કરાયેલ સુધારા વધારા કે ફેરફાર માટે અથવાતો કોઈપણ બાબતે ઉભા થયેલા પ્રશ્નો વાંધાઓ કે મતભેદો નગરપાલિકા દ્વારા નકકી કરેલ કોઈ પણ વ્યક્તિનો લવાદી દ્વારા નિકાલ કરવાનો રહેશે આ લવાદી ઈન્ડીયન આર્બીટેશન એક્ટ ૧૯૪૦ પ્રમાણે આર્કીટેક્ટ સુચવે તે સ્થળે કરાશે. અને આવા લવાદનો ચુકાદો આ કોન્ટ્રાક્ટની બન્ને પાર્ટીઓને બંધનકર્તા રહેશે.

(૧૪) જયુરીડીકશન:-

નગરપાલિકાની હેડ ઓફીસ જે શહેરમાં હોય તે સ્થળે આ કોન્ટ્રાક્ટ થયેલ ગણાશે અને તે શહેરની કોર્ટમાં જ બન્ને પાર્ટી વચ્ચેના વાંધાકે તકરારનો નિકાલ કરવાનો રહેશે.

ઘોલ નગરપાલિકા – ઘોલ

:::: કોન્ટ્રાક્ટની ખાસ શરતો ::::

- (૧) આ ટેન્ડર આઈટમ રેઈટ બેઈઝ પર માંગવામાં આવેલ છે જેમાં ભાવ ઈજારદારે ભરવાના રહેશે.
- (૨) ટેન્ડરમાં જણાવેલ તમામ સ્પેશીફિકેશનને ધ્યાને લઈ ભાવ ભરવાના રહેશે. તદ ઉપરાંત જો કોઈ વધારાની સુવિધા આપના દ્વારા આપવાની થતી હોય તો તેના માટે અલગથી તમામ વિગતો સહ અલગથી લેટરપેડ ઉપર ભાવ આપવાના રહેશે.
- (૩) તેમજ પ્રથમ વર્ષમાં મેઈન્ટેનન્સ બાબતની જોગવાઈ ઘોલ શહેર નજીક વર્કશોપનું સ્થળ જણાવવાનું રહેશે.
- (૪) દરેક આઈટેમોના અંદાજીત જથ્થામાં ગમે તેટલો વધારો કે ઘટાડો થઈ શકશે. અને કોઈ આઈટેમો સંપૂર્ણ પણે રદ થઈ શકશે કે નવી આઈટેમો ઉમેરી શકાશે. આમ છંતાય આવી આઈટેમો કે આઈટેમોના જથ્થા ના ફેરફાર થી ટેન્ડરમાં બતાવેલ આઈટેમના ભાવમાં કોઈપણ જાતનો ફેરફાર થશે નહીં.
- (૫) શેડ્યુલમાંની કોઈપણ આઈટેમ કે આઈટેમોના વર્ણન કે જથ્થામાં થયેલી ભુલ કે ક્ષતિ ના કારણે આ કોન્ટ્રાક્ટનો ભંગ થયો ગણાશે નહીં પરંતુ તેને ફેરફાર તરીકે ગણવામાં આવશે.
- (૬) ટેન્ડરમાં કોઈ આઈટમ સ્પેશીફિકેશન આપવામાં આવેલ ન હોય, તેવા સંજોગોમાં નગરપાલિકા દ્વારા જે સ્પેશીફાય કરવામાં આવે તે માન્ય રાખવાનું રહેશે.
- (૭) કામના થતા બિલ માંથી પ્રવર્તમાન દર મુજબ ઈન્કમ ટેક્સ તેમજ કામ મંજૂર થયેથી ૨.૫૦% મુજબ સિકયોરીટી ડિપોઝીટ ભરવાની રહેશે તેમજ કામના થતા બિલમાંથી ૨.૫૦% મુજબ સિકયોરીટી ડિપોઝીટ કપાત કરવામાં આવશે. કપાત કરેલ તથા ભરેલ સિકયોરીટી ડિપોઝીટ એમ મળી કુલ ૫.૦૦% મુજબની સિકયોરીટી ડિપોઝીટને પ્રોજેક્ટ સંતોષકારક રીતે પુરો થયે કમ્પલીશન સર્ટીફિકેટ મળ્યેથી એક-વર્ષ સુધી ઘોલ નગરપાલિકામાં પરફોર્મન્સ બોન્ડ રૂપે જમા રાખવામાં આવશે. થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન એજન્સીએ પોતાના ખર્ચે કરી રીપોર્ટ નગરપાલિકામાં સબમીટ કરવાના રહેશે.
- (૮) દરેક બિલ થયેલ કામના આઈટેમ રેઈટ મુજબની રકમના ૧૦૦% રકમની ચુકવણી કરવામાં આવશે તેમજ દરેક રનીંગ/ફાઈન બિલમાંથી અગાઉ ચુકવેલ પેમેન્ટ બાદ કરવામાં આવશે તેમજ દરેક રનીંગ/ફાઈન બિલમાંથી ૫% મુજબ રીટેન્શનમની કપાત કરવામાં આવશે જે રકમ સંપૂર્ણ કામ પુર્ણ થાય અને ફાઈનલ બિલના પેમેન્ટ થયાબાદ કમ્પલીશન સર્ટીફિકેટ મળ્યાબાદ છુટી કરવામાં આવશે.
- (૬) આ કામ માટે એજન્સી દ્વારા સિકયોરીટી ડિપોઝીટ પેટે જો એફ.ડી.આર. નેશનલાઈઝ બેંક ની રજૂ કરવામાં આવેતો કરાર આ કામની અંદાજીત કિંમત ના ૫% મુજબ આવતી રકમ ના ૪.૯૦% મુજબ સ્ટેમ્પ પેપર વાપરવા નો રહેશે. જ્યારે એજન્સી દ્વારા સિકયોરીટી ડિપોઝીટ પેટે બેંક ગેરંટી સરકાર માન્ય બેંક ની રજૂ કરવામાં આવશે તો કરાર રૂ. ૩૦૦/-ના સ્ટેમ્પ પેપર ઉપર કરાર કરવાનાં રહેશે.
- (૭) સદરહું ટેન્ડર ભરનાર એજન્સી પાસે જી.એસ.ટી અને પી.એફ ભરવાની જવાબદારી એજન્સીની રહેશે. સબંધીત કચેરી દ્વારા આ બાબતે કોઈ પશ્ચન ઉપસ્થિત થશે તો જવાબદારી સબંધીત એજન્સીની રહેશે.
- (૮) આ ટેન્ડર ઓફરની કાયદેસરતા આ ટેન્ડર ખુલ્યા પછીથી ૧૨૦ દિવસ સુધીની રહેશે.
- (૯) અધુરી અથવા અસ્પષ્ટ ઓફરને ગેરલાયક ઠરાવી શકાશે.
- (૧૦) કોઈપણ કારણ દર્શાવ્યા વિના કોઈપણ એક કે બધીજ ટેન્ડર ઓફરો રદ કરવાનો કે સ્વિકારવાનો હકક નગરપાલિકાને અબાધિત છે.
- (૧૧) કામ મંજૂર થયેથી જરૂરી કરાર કરવાના રહેશે તેમજ તેના માટે થતી સ્ટેમ્પ ડ્યુટી ઈજારદારે ભોગવાની રહેશે.
- (૧૨) સદર કામમાં તમામ મટીરીયલ્સ આઈ.એસ.આઈ. બાન્ડનું વાપરવાનું રહેશે.
- (૧૩) કોન્ટ્રાક્ટરશ્રીએ શેડ્યુલ-બીમાં ભરેલ ભાવ તમામ ટેક્સ, જી.એસ.ટી ટેક્સ, ટ્રાન્સપોર્ટ ભાડુ જેવો વિગેરે ચાર્જ સાથેનો ભરવાનો રહેશે. તે બાબતે કોઈપણ અલગથી ચાર્જ નગરપાલિકા દ્વારા આપવામાં આવશે નહીં. અને ભાવો મંજૂર થયા બાદ કોઈપણ ભાવ વધારો નગરપાલિકા તરફથી આપવામાં આવશે નહીં. તે વિગત જાણી એજન્સીએ ભાવો ભરવાના રહેશે.
- (૧૪) પી.વી.સી. ડસ્ટબીન કલર ગ્રીન(લીલો) અને બ્લુ કલર જ વાપરવાનો રહેશે. અને શેડ્યુલ-બીમાં જણાવ્યા મુજબ સપ્લાય કરી અને નગરપાલિકાના એન્જિનિયર તેમજ અધિકારી સુચવે તે મુજબ ખોદાણ કરી સી.સી.નું ફાઉન્ડેશન કરી કમ્પલેટ ફીટીંગ કરી આપવા સુધીના ભાવ ભરવાના રહેશે. તે બાબતે કોઈપણ અલગથી ચાર્જ નગરપાલિકા દ્વારા આપવામાં આવશે નહીં. અને ભાવો મંજૂર થયા બાદ કોઈપણ ભાવ વધારો નગરપાલિકા તરફથી આપવામાં આવશે નહીં. તે વિગત જાણી એજન્સીએ ભાવો ભરવાના રહેશે.

- (૧૫) સ્પેશ્યલ શરત : ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી તરફથી ૧લી જુલાઈ-૨૦૧૭ થી તમામ પ્રકારનાં વેપાર ધંધા / સર્વિસ સેક્ટર, સપ્લાયર્સ, કોન્ટ્રાક્ટરશ્રી ઉપર ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સનું (GST) ભારણ નાંખેલ છે આથી આ ટેક્સની તમામ જવાબદારી, ભવિષ્યની લાયેબીલીટી વિગેરે અંગેની સઘળી જવાબદારી મારી/ અમારી આ કામ રાખનાર કોન્ટ્રાક્ટરશ્રીની રહેશે અને આ અંગેનું પાલન મારે / અમારે અથવા અમારા વંશ-વાર સોને કબુલ મંજૂર, બંધનકર્તા રહેશે. અમારૂં ઉપરોક્ત વિગતવાળું કામ પૂર્ણ થાય, ફાઈનલ બીલ, સિક્યોરીટી ડીપોઝીટ રીલીઝ થઈ જાય ત્યારબાદ પણ ભવિષ્યમાં આ પ્રકારનાં અથવા સરકારશ્રી સુચવે તે મુજબનાં ટેક્સ ભરવાના સંજોગોમાં અમારે કામ રાખનાર સંસ્થામાં અથવા સંસ્થા સુચવે તે સરકારશ્રીનાં વિભાગમાં આ પ્રકારનાં કરવેરા ભરવા અંગેની સઘળી જવાબદારી મારી / અમારી આ કામ રાખનાર કોન્ટ્રાક્ટરશ્રી તરીકે અમારી રહેશે અને તે બદલ આ સ્પેશ્યલ શરતોમાં નીચે સાક્ષીની હાજરીમાં સહી / સક્રિયા કરી આપીએ છીએ.
- (૧૬) સદરહું કામમાં કોન્ટ્રાક્ટરશ્રીના રનીંગ/ફાઈનલ બિલ માંથી અનુક્રમે (૧) બિલ્ડીંગ, (૨) રોડ, (૩) બ્રિજ વિગેરે કામગીરીનો કન્સલ્ટન્ટ એન્જિનિયર ચાર્જ ટેન્ડરની અંદાજીત(વહીવટીની) રકમના ૧.૭૩%(ટકા) પ્રથમ બીલ માંથી તથા એજન્સીના રનીંગ/ફાઈનલ બીલની કુલ રકમના ૧.૭૩%(ટકા) મુજબ સુપરવિઝનના કપાત કરવા માં આવશે.
- (૧૭) ઉપરોક્ત કામોમાં શરતી ટેન્ડર સ્વિકાર્ય રહેશે નહીં તેમજ સદર કામ અંગેના તમામ હકક નગરપાલિકાને અબાધિત છે.
- (૧૮) વહીવટી મંજૂરીમાં આપેલ શરતો મુજબ કરારની તેમજ ખાસ શરતોમાં ફેરફાર કરવાની જરૂર જણાયતો ફેરફાર કરવાનો હકક ધ્રોલ નગરપાલિકાને રહેશે.

કોન્ટ્રાક્ટરની સહી

(નામ :)

ચીફ ઓફિસર
ધ્રોલ નગરપાલિકા
ધ્રોલ

પ્રમુખ
ધ્રોલ નગરપાલિકા
ધ્રોલ

:: ખાસ સુચના ::

- (૧) આ ટેન્ડર આઈટમ રેઈટ બેઈઝ પર માંગવામાં આવેલ છે. શેડ્યુલ આઈટેમ સામે કોન્ટ્રાક્ટરે પોતાના ભાવ આંકડામાં તેમજ શબ્દોમાં ભરી કુલ સરવાળો કરવાનો રહેશે.
- (૨) અનુભવના પ્રમાણપત્ર ફોર્મ ૩-એ ફક્ત માગ્યા મુજબના કામો છેલ્લા સાત-વર્ષમાં પુર્ણ કરેલા કામના જ માન્ય રાખવામાં આવશે. ફોર્મ ૩-એ નમુના સિવાયના અનુભવના પ્રમાણપત્ર માન્ય રાખવામાં નહીં આવે.
- (૩) ફક્ત એપેન્ડીક્ષ-૧માં જણાવ્યા મુજબ અનુભવના પ્રમાણપત્ર માન્ય રાખવામાં આવશે. અનુભવના પુર્ણ કરેલ કે ચાલુ કામના ૩-એ સર્ટીફિકેટમાં જોઈન્ટ વેન્યુચર વાળા ૩-એ સર્ટીફિકેટ માન્ય રહેશે નહીં, માગ્યા મુજબની એજન્સીમાં કોઈ એજન્સી સાથે જોઈન્ટ વેન્યુચર કરી ભાવો ભરેલ હશે તો તે માન્ય રાખવામાં નહીં આવે અને કામ પુર્ણ કર્યાના ૩-એ સર્ટીફિકેટમાં નીચે અપટુ રનીંગ બિલ દર્શાવેલ ૩-એ સર્ટીફિકેટ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. તેમજ વાર્ષિક રેઈટ કોન્ટ્રાક્ટના વર્ક ઓર્ડર અને તેના સંયુક્ત આપેલ ૩-એ કમ્પલીશન સર્ટીફિકેટ માન્ય રાખવામાં આવશે નહીં.
- (૪) અનુભવના પુર્ણ કરેલ કમ્પલીશન સર્ટીફિકેટમાં ટાઈમ લીમીટ એકટેન્શન કરી કામ પુર્ણ કરેલ હશે તો ઈસ્યુકરનાર સંસ્થા પાસે થી સંબંધિત એજન્સીની કામગીરી તેની વર્તુણક અને તેના વ્યવહાર બાબતની લેખીત ખરાઈ કરી તેમને ક્વોલીફાય કરવા ન કરવા તે બાબતે નગરપાલિકાને અબાધિત અધિકાર રહેશે.
- (૫) પેટા કોન્ટ્રાક્ટમાં કરેલ કામોના અનુભવ માન્ય રાખવામાં નહીં આવે. પેટા કોન્ટ્રાક્ટમાં ટી.ડી.એસ. કપાત કરેલ અનુભવના પ્રમાણપત્ર કે જે ૩-એ ફોર્મમાં હોય તો તે પણ માન્ય રાખવામાં નહીં આવે.
- (૬) અનુભવના પ્રમાણપત્રો ફક્ત સરકારી કે અર્ધ સરકારી સંસ્થાના જ માન્ય રાખવામાં આવશે. તેમાં પણ કોઈ કામ સંયુક્ત હોય તો ટેન્ડરમાં માગ્યા મુજબ પ્રમાણપત્રો કામની કિંમત ૩-એ ફોર્મમાં અલગ બતાવેલ હશે તેટલા જ ૩-એ પ્રમાણપત્ર માન્ય રાખવામાં આવશે.
- (૭) માંગવામાં આવેલ તમામ પ્રમાણપત્રોનું ઓનલાઈન તથા ફીઝીકલ સબમીશન કરવું ફરજિયાત છે. જેના આધારે ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે તથા અધુરા ડોક્યુમેન્ટ વાળા ટેન્ડરો રદ થવા પાત્ર રહેશે.
- (૮) માંગવામાં આવેલ તમામ પ્રમાણપત્રો તેમજ ટેન્ડર ફી માટેનો ડિમાન્ડ ડ્રાફ્ટ અને અર્નેસ્ટમની ડિપોઝીટ માટે ફીક્સ ડિપોઝીટ રીસીપ્ટ સ્કેન કરી ઓનલાઈન સબમીશન ફરજિયાત કરવાનું રહેશે. તદ્દ ઉપરાંત ટેન્ડરમાં જણાવેલ ડોક્યુમેન્ટ મોકલવાના નિયત સમય દરમિયાન માંગવામાં આવેલ તમામ સાધનિક કાગળોની સેલ્ફ એટેસ્ટેડ કરાવી તેમજ ઓરીજનલ ડિમાન્ડ ડ્રાફ્ટ અને ફીક્સ ડિપોઝીટ રીસીપ્ટ મોકલવાની રહેશે. ખરીનકલ વગરના કાગળો માન્ય ગણવામાં આવશે નહીં. જેથી ફરજિયાત ખરી નકલ વાળા કાગળો જ મોકલવાના રહેશે. તેમજ ફીઝીકલ સબમીશન કવર ઉપર ટેન્ડર આઈ.ડી અને આઈ.એફ.બી નંબર/ટેન્ડર નોટીસ નંબર એજન્સીએ ફરજિયાત લખવાનું રહેશે. તેમજ નિયત સમય-મર્યાદામાં ન આવેલ ફીઝીકલ સબમીશન ધ્યાને લેવામાં નહીં આવે. અને તે ફીઝીકલ સબમીશન કવર નગરપાલિકા દ્વારા એજન્સીને પરત મોકલવામાં આવશે. જેની એજન્સીએ ખાસ નોંધ લેવાની રહેશે.
- (૯) આ કામ માટે એજન્સી દ્વારા સિક્યોરીટી ડિપોઝીટ પેટે જો એફ.ડી.આર. નેશનલાઈઝ બેંક ની રજૂ કરવામાં આવેતો કરાર આ કામની અંદાજિત કિંમતના ૫% મુજબ આવતી રકમના ૪.૯૦% મુજબ સ્ટેમ્પ પેપર વાપરવાનો રહેશે. જ્યારે એજન્સી દ્વારા સિક્યોરીટી ડિપોઝીટ પેટે બેંક ગેરંટી સરકાર માન્ય બેંક ની રજૂ કરવામાં આવશે તો કરાર રૂ. ૩૦૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર કરવાનાં રહેશે.
- (૧૦) ઉપરોક્ત સુચનાનું અનુસરણ ન થયેલ હોય તેવા ટેન્ડરો રદ થવા પાત્ર રહેશે.
- (૧૧) ટેન્ડરો મંજૂર કરવા, નામંજૂર કરવા કે રદ કરવા અંગેના તમામ અધિકાર ધ્રોલ નગરપાલિકાને અબાધિત રહેશે.

કરારનામું (કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ)

લખાવી લેનાર :

- (૧) પ્રમુખ, ધ્રોલ નગરપાલિકા, જિ : જામનગર
(૨) ચીફ ઓફીસર, ધ્રોલ નગરપાલિકા, જિ : જામનગર

લખી આપનાર :

એજન્સી :
.....
.....

કામનું નામ: સને ૨૦૨૪-૨૫ વર્ષની માન. ધારાસભ્યશ્રીની યોજના અંતર્ગત ૧૩૫-નંગ ૧૦૦ લીટર કેપેસિટીની સ્ટેન્ડ સાથે ડ્યુલ બીન વાળી ડસ્ટબીન સપ્લાય કરી ફીટીંગ કરવાનું કામ. (બીજો પ્રયત્ન)

ધ્રોલ નગરપાલિકા જોગ લખી આપનાર સપ્લાયર..... રહેવાસી.....
જત આ એગ્રીમેન્ટ થી લખી આપું છું કે, મે ધ્રોલ નગરપાલિકામાં ૧૩૫-નંગ ૧૦૦ લીટર કેપેસિટીની સ્ટેન્ડ સાથે ડ્યુલ બીન વાળી ડસ્ટબીન સપ્લાય કરી ફીટીંગ સાથે ભાવનું ઈ-ટેન્ડર ભરેલ તે મંજૂર થતા આ કામ રૂા..... પ્રતિ નંગનાં છે. તે કામ સપ્લાય સાથે ફીટીંગ કરવાનું કામ રાખેલ છે. તે કામ નીચે જણાવેલ શરતો તથા સમજૂતીથી રાખેલ છે.

:: શરતો ::

- (૧) આપના તરફથી ભરેલ ટેન્ડરમાં દર્શાવેલ સ્પેશીફિકેશન તથા શરતો મુજબની વિગતે ૧૩૫-નંગ ૧૦૦ લીટર કેપેસિટીની સ્ટેન્ડ સાથે ડ્યુલ બીન વાળી ડસ્ટબીન સપ્લાય કરી ફીટીંગ કરવાનાં રહેશે.
- (૨) ઉપરોક્ત જણાવેલ ૧૩૫-નંગ ૧૦૦ લીટર કેપેસિટીની સ્ટેન્ડ સાથે ડ્યુલ બીન વાળી ડસ્ટબીન સપ્લાય કરી ફીટીંગ ની જરૂરી તાલીમ ફી મા કર્મચારીઓને આપવાની રહેશે.
- (૩) ઉપરોક્ત જણાવેલ ૧૩૫-નંગ ૧૦૦ લીટર કેપેસિટીની સ્ટેન્ડ સાથે ડ્યુલ બીન વાળી ડસ્ટબીન સપ્લાય કરી ફીટીંગ કરી તમામ ટેકસ, જી.એસ.ટી ટેકસ સાથે નો હોય જેથી નગરપાલિકા દ્વારા વધારાનાં કોઈ પણ જાતનાં ટેકસ ચુકવવામાં આવશે નહીં. ફોર ધ્રોલ નગરપાલિકા સુધીનું રહેશે.
- (૪) ઉપરોક્ત જણાવેલ ૧૩૫-નંગ ૧૦૦ લીટર કેપેસિટીની સ્ટેન્ડ સાથે ડ્યુલ બીન વાળી ડસ્ટબીન સપ્લાય કરી ફીટીંગ કરી તેની વોરંટી ૧૨-માસની રહેશે.
- (૫) ઉપરોક્ત જણાવેલ ૧૩૫-નંગ ૧૦૦ લીટર કેપેસિટીની સ્ટેન્ડ સાથે ડ્યુલ બીન વાળી ડસ્ટબીન નગરપાલિકાની સુચના મુજબ સપ્લાય કરી ફીટીંગ કરવાનું રહેશે.
- (૬) ઉપરોક્ત જણાવેલ ૧૩૫-નંગ ૧૦૦ લીટર કેપેસિટીની સ્ટેન્ડ સાથે ડ્યુલ બીન વાળી ડસ્ટબીનની ધ્રોલ નગરપાલિકાની સુચના મુજબ ધ્રોલ નગરપાલિકા બન્ને બાજુ લખવાનું રહેશે. ટેન્ડરમાં પાસ થયેલ રકમથી વધારે કોઈપણ જાતનો વધારાનો કે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ ચુકવવાનો રહેશે નહીં.
- (૭) અમોએ ભરેલ ભાવો નક્કી થયેલ શરતો તથા ઉપરોક્ત સ્પેશીફિકેશન તથા શરતો મુજબ સપ્લાય કરીશું.
- (૮) વર્ક ઓર્ડર મળ્યેથી ૩૦-કાર્યરત દિવસમાં ઉપરોક્ત જણાવેલ ૧૩૫-નંગ ૧૦૦ લીટર કેપેસિટીની સ્ટેન્ડ સાથે ડ્યુલ બીન વાળી ડસ્ટબીન સપ્લાય કરી ફીટીંગ કરવાનું રહેશે.
- (૯) સચોટ કારણોસર માલ-સામાન સમય મર્યાદામાં પૂર્ણ કરી ન શકાય તો વ્યાજબી કારણોસર સમય મર્યાદા એજન્સીની અરજી અન્વયે વધારી આપવાની સત્તા ચીફ ઓફીસર સાહેબ/પ્રમુખ સાહેબ ધ્રોલ નગરપાલિકા ની છે.
- (૧૦) આ કામમાં વાપરવામાં આવતા તમામ માલ-સામાન ઉપર જી.એસ.ટી ટેકસ તેમજ ઈન્કમેટેક્સ સરકારશ્રીમાં જમા કરાવવાની સંપૂર્ણ જવાબદારી એજન્સીની રહેશે.
- (૧૧) સંપૂર્ણ કાર્ય સંસ્થાનાં પ્રમુખ સાહેબ તથા ચીફ ઓફીસર સાહેબ તેમજ કન્સલ્ટીંગ એન્જનીયરની સુચના તેમજ માર્ગદર્શન અનુસાર કરવાનું રહેશે.
- (૧૨) ઓર્ડર મુજબનો માલ તૈયાર થયાની નગરપાલિકાને જાણ કરી માલનું ઈન્સ્પેક્શન કરાવી લેવાનું રહેશે એન તે અંગેનો રીપોર્ટ રજૂ કરવાનો રહેશે.
- (૧૩) સપ્લાય થયેલ માલ-સામાનમાં કોઈ મેન્યુફેક્ચરીંગ ખામી જણાશે તો તે ખામીયુક્ત માલ-સામાન દિવસ-૭માં પોતાના ખર્ચે અને જોખમે રીપ્લેસ કરી આપવાનો રહેશે.
- (૧૪) મંજૂર થયેલ ભાવ મુજબ ૧૩૫-નંગ ૧૦૦ લીટર કેપેસિટીની સ્ટેન્ડ સાથે ડ્યુલ બીન વાળી ડસ્ટબીનની ગુણવત્તાયુક્ત તેમજ તેની કાયદેસરતાની જવાબદારી લખી આપનારની રહેશે.
- (૧૫) ચાલુ કામ દરમ્યાન સંસ્થાના સક્ષમ અધિકારી અગર તો ઈનચાર્જ ઓફીસર તરફથી કામ સંબંધે જે કાંઈ સામાન્ય સુચનો, હુકમો વિગેરે કરવામાં આવે તે પ્રમાણે કામ કરવાનું રહેશે. આવી તમામ સુચનાઓનું પાલન કરવા અને

અમલ કરવાની જવાબદારી કામ કરનાર એજન્સીની રહેશે.

- (૧૬) આ કામ સમય મર્યાદામાં પુરૂ ન થાય તો ટેન્ડરમાં જણાવ્યા અનુસાર પેનલ્ટી ધ્રોલ નગરપાલિકા વસુલ કરી શકશે.
- (૧૭) કામના થતા બિલ માંથી પ્રવર્તમાન દર મુજબ ઈન્કમ ટેક્સ તેમજ કામ મંજૂર થયેથી ૨.૫૦% મુજબ સિક્યોરીટી ડિપોઝીટ ભરવાની રહેશે તેમજ કામનાં થતા બિલમાંથી ૨.૫૦% મુજબ સિક્યોરીટી ડિપોઝીટ કપાત કરવામાં આવશે. કપાત કરેલ તથા ભરેલ સિક્યોરીટી ડિપોઝીટ એમ મળી કુલ ૫.૦૦% મુજબની સિક્યોરીટી ડિપોઝીટને પ્રોજેક્ટ સંતોષકારક રીતે પુરો થયે કમ્પલીશન સર્ટીફિકેટ મળ્યેથી એક-વર્ષ સુધી ધ્રોલ નગરપાલિકામાં પરફોર્મન્સ બોન્ડ રૂપે જમા રાખવામાં આવશે.
- (૧૮) આ કામમાં કોઈપણ જાનમાલની હાની થાય કે કોઈપણ જાતનાં અકસ્માત થાય તો તે અંગેની વર્કમેન કમ્પેસેશન એક્ટ અન્વયે જે કોઈ જવાબદારી ઉભી થાય તેની સંપૂર્ણ જવાબદારી એજન્સીની રહેશે.
- (૧૯) ફક્ત મટીરીયલ્સનું કોઈ એડવાન્સ પેમેન્ટ આપવામાં આવશે નહીં તેમજ બજાર કિંમતમાં થતા વધારા મુજબ કોઈ ભાવ વધારો માલ-સામાનમાં આપવામાં આવશે નહીં.
- (૨૦) કુદરતી રીતે કોઈપણ નુકશાન થાય તેમજ કામ દરમ્યાન કોઈપણ મજૂર, કારીગર, સુપરવાઈઝર કે અન્ય વ્યક્તિને ઈજા થાય અથવા મૃત્યુ પામે તો તેની સંપૂર્ણ જવાબદારી એજન્સીની રહેશે.
- (૨૧) સપ્લાયરે મંજૂર થયેલ ભાવ મુજબ ૧૩૫-નંગ ૧૦૦ લીટર કેપેસિટીની સ્ટેન્ડ સાથે ડયુલ બીન વાળી ડસ્ટબીન સપ્લાય કરી ફીટીંગ સાથે પુરૂ પાડવાનું રહેશે. પાછળથી કોઈપણ સંજોગોમાં ભાવ વધારની કે અન્ય ખર્ચની માંગણી ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.
- (૨૨) આ કામ માટે જરૂરી જણાયે માલની ટેકનીકલ ચકાસણી નગરપાલિકાને યોગ્ય લાગે તેવા ટેકનિકલ કન્સલ્ટન્ટ કે તે ની પેનલ દ્વારા ગુણવત્તા સંબંધી કોઈપણ ચકાસણી કે તપાસ કરાવી શકશે. જો તેમાં ક્ષતિ જણાશે તો નગરપાલિકા ના ચીફ ઓફિસરશ્રી જે નિર્ણય લેશે તે આખરી ગણાશે.
- (૨૩) આ કામ વ્યવસ્થીત સ્પેશીફિકેશન મુજબ નહીં કરવામાં આવે તેમજ કામમાં ઢીલ કરશે તો આ કામ મારા ખર્ચે અને જોખમે અન્ય એજન્સી પાસે કરાવી લેવા ધ્રોલ નગરપાલિકા મુખત્યાર છે તેમજ આવા સંજોગોમાં સીક્યોરીટી ડિપોઝીટની રકમ જપ્ત કરવા તથા થયેલ કામમાંથી થયેલ વધારાનો તમામ ખર્ચ વસુલ લેવા ધ્રોલ નગરપાલિકા મુખત્યાર છે.
- (૨૪) સ્પેશ્યલ શરત: ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી તરફથી ૧લી જુલાઈ-૨૦૧૭ થી તમામ પ્રકારનાં વેપાર ધંધા / સર્વિસ સેક્ટર, સપ્લાયર્સ, કોન્ટ્રાક્ટરશ્રી ઉપર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનું (GST) ભારણ નાંખેલ છે આથી આ ટેક્સની તમામ જવાબદારી, ભવિષ્યની લાયબીલીટી વિગેરે અંગેની સઘળી જવાબદારી મારી/ અમારી આ કામ રાખનાર કોન્ટ્રાક્ટરશ્રીની રહેશે અને આ અંગેનું પાલન મારે / અમારે અથવા અમારા વંશ-વાર સોને કબુલ મંજૂર, બંધનકર્તા રહેશે. અમારૂં ઉપરોક્ત વિગતવાળું કામ પૂર્ણ થાય, ફાઈનલ બીલ, સિક્યોરીટી ડીપોઝીટ રીલીઝ થઈ જાય ત્યારબાદ પણ ભવિષ્યમાં આ પ્રકારનાં અથવા સરકારશ્રી સુચવે તે મુજબનાં ટેક્સ ભરવાના સંજોગોમાં અમારે કામ રાખનાર સંસ્થામાં અથવા સંસ્થા સુચવે તે સરકારશ્રીનાં વિભાગમાં આ પ્રકારનાં કરવેરા ભરવા અંગેની સઘળી જવાબદારી મારી / અમારી આ કામ રાખનાર કોન્ટ્રાક્ટરશ્રી તરીકે અમારી રહેશે અને તે બદલ આ સ્પેશ્યલ શરતોમાં નીચે સાક્ષીની હાજરીમાં સહી / સહિકા કરી આપીએ છીએ.
- (૨૫) સદર કામમાં તમામ મટીરીયલ્સ આઈ.એસ.આઈ. બાન્ડનું વાપરવાનું રહેશે.
- (૨૬) પી.વી.સી. ડસ્ટબીન કલર ગ્રીન(લીલો) અને બ્લુ કલર જ વાપરવાનો રહેશે. અને શેડયુલ-બીમાં જણાવ્યા મુજબ સપ્લાય કરી અને નગરપાલિકાના એન્જીનિયર તેમજ અધિકારી સુચવે તે મુજબ ખોદાણ કરી સી.સી.નું ફાઉન્ડેશન કરી કમ્પલેટ ફીટીંગ કરી આપવા સુધીના ભાવ ભરવાના રહેશે. તે બાબતે કોઈપણ અલગથી ચાર્જ નગરપાલિકા દ્વારા આપવામાં આવશે નહીં. અને ભાવો મંજૂર થયા બાદ કોઈપણ ભાવ વધારો નગરપાલિકા તરફથી આપવામાં આવશે નહીં. તે વિગત જાણી એજન્સીએ ભાવો ભરવાના રહેશે.
- (૨૭) એગ્રીમેન્ટની કોઈપણ શરતો ભંગ થશે તો તાત્કાલીક કરાર રદ કરવામાં આવશુ તથા સપ્લાયરના ખર્ચે અને જોખમે નગરપાલિકા આ ખરીદી અન્ય પાસેથી કરશે.
- (૨૮) આ કરારની તમામ શરતોનું અર્થઘટન ધ્રોલ નગરપાલિકા કરશે તે અમને બંધનકર્તા રહેશે અને કોઈપણ શરતમાં વ્યવહારુ ફેરફાર કે અર્થઘટન કરવાની તમામ સત્તા ચીફ ઓફિસરને રહેશે.
- (૨૯) કોન્ટ્રાક્ટરશ્રીએ શેડયુલ-બીમાં ભરેલ ભાવ તમામ ટેક્સ, જી.એસ.ટી ટેક્સ, ટ્રાન્સપોર્ટ ભાડુ જેવો વિગેરે ચાર્જ

સાથેનો ભરવાનો રહેશે. તે બાબતે કોઈપણ અલગથી ચાર્જ નગરપાલિકા દ્વારા આપવામાં આવશે નહીં. અને ભાવો મંજૂર થયા બાદ કોઈપણ ભાવ વધારો નગરપાલિકા તરફથી આપવામાં આવશે નહીં. તે વિગત જાણી એજન્સીએ ભાવો ભરવાના રહેશે.

(૩૦) સદરહું કામમાં કોન્ટ્રાક્ટરશ્રીના રનીંગ/ફાઈનલ બિલ માંથી અનુક્રમે (૧) બિલ્ડીંગ, (૨) રોડ, (૩) બ્રિજ વિગરે કામગીરીનો કન્સલ્ટન્ટ એન્જિનિયર ચાર્જ ટેન્ડરની અંદાજિત(વહીવટીની) રકમના ૧.૭૩%(ટકા) પ્રથમ બીલ માંથી તથા એજન્સીના રનીંગ/ફાઈનલ બીલની કુલ રકમના ૧.૭૩%(ટકા) મુજબ સુપરવિઝનના કપાત કરવા માં આવશે.

ઉપર મુજબની શરતો ૧ થી ૩૦ જે કરાર અમોને કબુલ મંજૂર તથા બંધનકર્તા છે અને રહેશે જે બદલ અમો નીચે સહી કરી આપીએ છીએ.

આ કરારનામું રૂપિયા ૩૦૦ નાં નોન જયુડીશીયલ સ્ટેમ્પ પેપર્સ જેની તારીખ જેના પહેલા સ્ટેમ્પ પેપરનાં રજી.નં. થી સ્ટેમ્પ ૧ થી તથા કોરા લેઝર પાના જોડી કુલ પાના ઉપર ટાઈપ કરાવી આપેલ છે.

આ એગ્રીમેન્ટ અમો રાજીખુશીથી જીવ કાયમ રાખી વીના કેફે કોઈપણ જાતનાં દબાણ સીવાય લખી આપેલ છે તે મને તથા મારા વંશ વારશોને તથા મારા વકીલને કબુલ મંજૂર છે. ઉપર જણાવેલ શરતો મેં કબુલેલ છે તેની ખાત્રી બદલ આ સહી શાખ કરી આપેલ છે.

સ્થળ : ધ્રોલ

તા.

.....

(એજન્સીની સહી)

શાખો :- (નામ તથા સરનામું)

(૧)
.....
.....

ચીફ ઓફીસર
ધ્રોલ નગરપાલીકા
ધ્રોલ

(૨)
.....
.....

પ્રમુખ
ધ્રોલ નગરપાલીકા
ધ્રોલ